

RAN-2408000604030005

S. Y. B. Com. NCF-NEP (Sem.-IV) Examination April - 2026

Minor Banking Law and Practice (Paper-III)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના આંકડા પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figures to the right indicate full marks of the question.	Seat No.: <table border="1"> <tr> <td></td><td></td><td></td><td></td><td></td><td></td> </tr> </table> Student's Signature						

- Q. 1.** નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (કોઈપણ પાંચ) 10
Answer the following question in brief. (Any five) 10
- ચેકની વસૂલાતની માત્ર રીતો જણાવો.
1. Give only the method of collection of the cheque.
 - ચેકમાં મહત્વના ફેરફાર એટલે શું?
2. What are significant changes in a cheque?
 - કાસા (CASA) ડિપોઝિટનું સૂત્ર આપો.
3. Give the formula of CASA deposit.
 - મુખ્ય હકીકત પત્રક (કીફક્ટસ્ટેટમેન્ટ)ની વ્યાખ્યા આપો.
4. Give the definition of the Key Fact Statement.
 - બિનરક્ષિત લોન એટલે શું?
5. What is unsecured loan?
 - ધિરાણનાં વિવિધ પ્રકારો જણાવો.
6. State the different types of loans.
 - લોનના છુપાયેલા (Hidden) ચાર્જ શું છે?
7. What is the Loan Hidden charge?
- Q. 2.** બેંકરે ચેકના નાણાં ચૂકવતા પહેલાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? સમજાવો. 14
Explain what precautions a banker should take before making the payment of a Cheque. 14
- અથવા/OR**
- Q. 2.(અ)** ચેકની વસૂલાત કરનાર બેન્કરની ફરજો સમજાવો. 07
(A) Explain the duties of a Banker who Collects a cheque 07
- (બ)** ચેકનો અયોગ્ય નકાર એટલે શું? ચેકના અયોગ્ય નકારની અસરો જણાવો. 07
(B) What is wrongful dishonour of a cheque? Describe the effects of wrongful dishonor of a cheque. 07

- Q. 3.** બેન્ક એડવાન્સિસના વિવિધ સ્વરૂપો સમજાવો. 14
 Explain the different forms of the bank advances. 14
અથવા/OR
- Q. 3.(અ)** બેંકો માટે કાસા (CASA) ડિપોઝીટનું મહત્વ વર્ણવો. 07
 (A) Describe the importance of CASA for bankers. 07
- (બ) બેંકો માટે સિબિલ (CIBIL) સ્કોરનું મહત્વ સમજાવો. 07
 (B) Explain the importance of the CIBIL score for banks 07
- Q. 4.(અ)** ટૂંકનોંધ લખો. (ગમે તે એક) 06
 1. વાર્ષિક ટકાવારી રેટ (APR)
 2. અવેજ આપ્યા બદલ ચેકના માલિક તરીકે
- (A) Write a short note: (Any one)** 06
 1. Annual Percentage Rate (APR).
 2. The banker as holder for value
- (બ) નીચેના સંજોગોમાં બેન્કર તરીકે તમે શું કરશો?** 06
 1. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સુરતનો એક ગ્રાહક જે સરકારી કર્મચારી છે. જે હાઉસિંગ લોન લેવા માટે બેંકમાં અરજી કરે છે. બેંકમાં લોનની કાર્યવાહી કરવા માટે નાં જરૂરી દસ્તાવેજો પણ આપે છે. બેન્કર તરીકે તમે લોન મંજૂર કરવા કયા પ્રકારનાં સિબિલ સ્કોરનો અભ્યાસ કરશો? શા માટે?
 2. શ્રી વિજય પટેલ નું BOB માં ચાલુ ખાતું છે. આ ચાલુ ખાતામાં રૂપિયા 1,50,000 જમાં સિલક છે. જે નીચે જણાવેલ ત્રણ ચેકો લખવામાં આવે છે અને ક્લિયરિંગ માટે એક સમયે રજૂ થાય છે:
 ચેક નંબર - 1 રૂપિયા 1,50,000
 ચેક નંબર - 2 રૂપિયા 40,000
 ચેક નંબર - 3 રૂપિયા 1,10,000
- (B) What would you do as a banker in the following circumstances?** 06
 1. A customer of State Bank of India Surat who is a government employee who applies to the bank for a housing loan. He also provides the necessary documents to process the loan in the bank. As a banker, what kind of CIBIL score will you study to approve the loan? Why?
 2. Mr. Vijay Patel has a current account in BOB. There is a credit balance of Rs.1,50,000 in this current account. The following three cheques drawn by him are presented in the clearing at the same time:
 Cheque No. - 1 Rs. 1,50,000
 Cheque No. - 2 Rs. 40, 000
 Cheque No. - 3 Rs. 1,10,000